

**B.A. Semester - 6 (CBCS) Examination
July-2025 (OLD COURSE)**

ECONOMICS : P22 BANKING AND FINANCIAL MARKET - 2(CORE - 22)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ ભારતમાં વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણના કારણો જણાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ ભારતમાં બેંકિંગ માળખાનું મૂલ્યાંકન કરો.
- પ્રશ્ન-૨ નાબાર્ડના હેતુઓ અને કાર્યો સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ ભારતમાં રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકોની સમસ્યા ચર્ચો.
- પ્રશ્ન-૩ ભારતમાં બિનબેંકિંગ ધિરાણ મધ્યસ્થીઓનો વિકાસ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ ભારતમાં બિનબેંકિંગ ધિરાણ સંસ્થાઓનું મૂલ્યાંકન કરો.
- પ્રશ્ન-૪ સેબીના કાર્યો વિશે વિગતે ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનોની વિગતે ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
1. પ્રાદેશિક ગ્રામીણ બેંકો.
 2. વિદેશીબેંકોનું મહત્વ.
 3. વિકાસ બેંકોની લાક્ષણિકતાઓ.
 4. RBI ના શાખ-નિયંત્રણની નીતિના ઉદ્દેશો.

ENGLISH VERSION

- Que-1 Give reason for Nationalization of Commercial Banks in India. (14)
OR
- Que-1 Evaluation of Banking structure in India.
- Que-2 Explain the objectives and functions of NABARD. (14)
OR
- Que-2 Discuss problems of Nationalized commercial Banks.
- Que-3 Explain development of Non-Banking Financial Intermedian in India. (14)
OR
- Que-3 Evaluate Non-Banking Financial Institutes in India.
- Que-4 Discuss in detail the functions of SEBI. (14)
OR
- Que-4 Discuss in detail the qualitative measures of credit control.
- Que-5 Write short notes: (Any two) (14)
1. Regional Rural Banks.
 2. Importance of Foreign Banks.
 3. Characteristics of development Banks.
 4. Objectives of credit control policy of Reserve Bank of India.
